

Nila/Cs/2019/316 Date: November 13, 2019

To,
The Department of Corporate Services
BSE Limited
Phiroze Jeejeebhoy Towers
Dalal Street, Fort,
Mumbai - 400 001

Scrip Code: 530377

....

To,
The Listing Department
National Stock Exchange of India Limited
Exchange Plaza, Plot no. C/1, G Block,
Randra Kurla Complay, Pandra (F)

Bandra-Kurla Complex, Bandra (E), Mumbai - 400 051

Scrip Symbol: NILAINFRA

Dear Sir,

Reg: Submission of Newspaper Publication of Extract of Financial Results for the quarter and six months ended on September 30, 2019

Pursuant to Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we are hereby submitting newspaper publication of Extract of Unaudited Standalone & Consolidated Financial Results for the quarter and six months ended on September 30, 2019, as published in the Business Standard- English and Loksatta Jansatta- Gujarati in November 13, 2019 edition.

Kindly take the same on your record and acknowledge the receipt.

Thanking you, Yours faithfully,

Sinell

For, Nila Infrastructures Limited

Dipen Y Parikh Company Secretary

Membership Number: A24031

Encl: a/a



Registered Office:

1st floor, Sambhaav House Opp. Chief Justice's Bungalow Bodakdev, Ahmedabad 380015 Tel.: +91 79 4003 6817 / 18, 2687 0258 Fax: +91 79 3012 6371

e-mail: info@nilainfra.com

CIN: L45201GJ1990PLC013417

www.nilainfra.com



SIP Triumph

State level Summer Project Competition named "Parishti" was organized by GLS Anamed "Parishti was organized 2, University Ahmedabad, for students pursuing MBA, PGDM or equivalent course in management across the state of Gujarat. The main objective of competition was to act as a bridge to understand industry dynamics and learn implementation of the theoretical concepts studied during the course. Twenty-Five colleges had participated in the competition. Miss. Saloni Shah represented the college and had secured the 1st position.



She had done her internship in the sales and marketing department in Hindustan Coca-Cola beverage

Pvt. Ltd. Her project was to study distribution and to increase salience of Coca-Cola in west Ahmedabad. – Bharat Ramchandani, Isha Jhatakia

IBS: CONVOCATION - CLASS OF 2019

he Convocation Ceremony was held on 19th October, at IBS-A campus for the students of the batch 2019. The Convocation began with a Grand Academic Procession followed by National song sung by the students. A Scintillating Award ceremony for the Best Performer, Best Outgoing Manager and Best Incoming Manager was followed by lighting the lamp by the guests as well as the faculty members. All the Graduates were awarded their Medals and Certificates. The students and the audience were enthralled by rousing speech of the chief guest, Mr. Harsh Kumar, Chief Human Resource Officer of CSB Bank Limited.

He emphasized more on the upcoming technology and the concept of - "Learn, Unlearn and Relearn". The



ceremony was closed by taking the pledge of integrity

and the event was a great success. – Bharat Ramchandani, Isha Jhatakia

LDRP MBA Igniting the entrepreneurial minds - A visit to CED

The entrepreneurs are not born; they are made". LDRP MBA students visited a place where such successful entrepreneurs are made - CED, Centre for Entrepreneurial Development, Gujarat. The students attended an awareness session on the activities of the centre and the learning opportunities that are available for them. Few case studies on "successful entrepreneurs after attending CED sessions" were discussed. Students understood the fact that to start a new venture, more than motivation and management, social and economical responsibility is crucial. They also received insights on how to run a business

in a long run and how to make it customer friendly to

maximize profits. The faculty members of CED also dis-



cussed about the tools used for marketing research and analysis to find out the target market needs. The visit has definitely increased the number of students who might think entrepreneurship as their career option.

Vinyl Chemicals (India) Limited

CIN: L24100MH1986PLC039837

Regd. Office: 7th Floor, Regent Chambers, Jamnalal Bajaj Marg, 208, Nariman Point, Mumbai - 400 021. Tel: 2282 2708 Fax: 2204 3969 E-mail: cs.vinylchemicals@pidilite.com Website: www.vinylchemicals.com EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER & HALF YEAR ENDED 30.09.2019

For the Quarter ended For the Half Year ended 30.09.2019 30.09.2018 30.09.2019 30.09.2018 **Particulars** Unaudited Unaudited Unaudited Unaudited Total income 10613 14454 19295 24035 Profit/(loss) for the period before tax (36) 343 447 133 86 Profit/(loss) for the period after tax 261 (26)333 Total Comprehensive Income for the period 261 (26)333 86 [comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax)] Equity Share Capital (Face value of share: ₹1) 183 183 183 183 Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year Earnings per share of ₹1 each in ₹: Basic @1.43 @(0.14 @1.82 @0.47 Diluted @1.43 @1.82 @0.47

@ For the period only and not annualised

Note:

The above is an extract of the detailed Unaudited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full Unaudited Financial Results are available on the Websites of BSE Ltd. www.bseindia.com and National Stock Exchange of India Ltd. www.nseindia.com and on the Company's Website www.vinylchemicals.com. M.B. PAREKH

Chairman & Managing Director (DIN: 00180955) Dated: 12th November, 2019

INDOKEM LIMITED

CIN NO: L31300MH1964PLC013088 Registered Office: Plot No. 410/411, Khatau House, Mogul Lane, Mahim, Mumbai 400 016.

Tel No.: 61236767/61236711 Email - iklsecretarial@gmail.com Statement of Unaudited Financial Results for the quarter and half year ended September 30, 2019

	Particulars		Quarter ended		Half yea	Year	
		September 30, 2019 (Unaudited)	June 30, 2019 (Unaudited)	September 30, 2018 (Unaudited)	September 30, 2019 (Unaudited)	September 30, 2018 (Unaudited)	ended March 31, 2019 (Audited)
1	Total income from operations	2,444	2,075	2,131	4,519	4,150	8,073
2	Profit/ (Loss) before tax	13	(104)	51	(91)	77	(98)
3	Profit/ (Loss) from continued operations after tax	13	(104)	51	(91)	77	(98)
4	Profit/ (Loss) from discontinued operations before tax	-	-	(4)	-	(7)	(18)
5	Profit/ (Loss) from discontinued operations after tax	-	-	(4)	-	(7)	(18)
6	Total comprehensive income/ (loss) net of tax	13	(104)	47	(91)	70	(106)
7	Paid-up equity share capital						
ı	(face value of Rs. 10/- each)	2,433	2,433	2,433	2,433	2,433	2,433
8	Reserves	-	-	-	-	-	404
9	Earnings per share (EPS) (not annualised)						
	Total Earnings per share						
	(a) Basic (in Rs.)	0.05	(0.43)	0.19	(0.38)	0.29	(0.47)
	(b) Diluted (in Rs.)	0.05	(0.43)	0.19	(0.38)	0.29	(0.47)
	ATTO.		•			•	

NOTES:

Place : Mumbai

Date: November 12, 2019

The above financial results were reviewed by the Audit Committee and approved by the Board of Directors at the meeting held on November 12, 2019.

The Company operates in two segments, viz. textile dyes and chemicals and electrical capacitors. However the segment reporting for electrical capacitors is not disclosed separately, as the same does not qualify for separate disclosure as per Ind-AS 108 on operating segments.

The figures of the previous period(s)/ year have been regrouped/ reclassified wherever necessary.

For Indokem Limited Sd/ Mahendra K Khatau Chairman & Managing Director DIN: 00062794



NILA INFRASTRUCTURES LIMITED

(CIN No: L45201GJ1990PLC013417)

Registered Office: 1st Floor, Sambhaav House, Opp. Chief Justice's Bungalow, Bodakdev, Ahmedabad - 380 015. Phone: +91 79 4003 6817/18 Fax: +91 79 26873922

E-mail: secretarial@nilainfra.com Website: www.nilainfra.com

EXTRACTS OF UNAUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30 SEPTEMBER 2019

	1								
S.N.	Particulars		Quarter ended		Half yea	Year ended			
0.14.	Turticulars	30 Sept. 2019	30 June 2019	30 Sept. 2018	30 Sept. 2019	30 Sept. 2018	31 March 2019		
			(Unaudited)						
1	Total Income from Operations	5,662.95	5,262.52	4,725.03	10,925.47	9,713.64	21,978.54		
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional items	624.24	544.46	631.88	1,168.70	1,208.51	2,803.43		
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional items)	624.24	544.46	631.88	1,168.70	1,208.51	2,803.43		
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional items)	584.55	385.21	441.20	969.76	896.31	2,001.25		
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	582.18	382.86	438.65	965.04	891.19	2,025.56		
6	Equity Share Capital (Face Value of ₹ 1/- per share)	3,938.89	3,938.89	3,938.89	3,938.89	3,938.89	3,938.89		
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year						7,895.48		
8	Earning per share of ₹ 1/- each (from Continuing and Discontinuing Operations)								
	Basic (in ₹)	0.15	0.10	0.11	0.25	0.23	0.51		
	Diluted (in ₹)	0.15	0.10	0.11	0.25	0.23	0.51		

The above is an extract of the detailed format of Quarterly Financial Results reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on November 12, 2019 and the same is filed with the BSE Limited and National Stock Exchange of India Limited under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of Quarterly Financial Results and Notes thereto are available on the website of the Stock Exchanges at www.bseindia.com and www.nseindia.com and also on the Company's website at www.nilainfra.com.

Additional Information pursuant to Regulation 47(1)(b) of the SEBI (LODR) Regulations, 2015 on key standalone un-audited financial information of the company is given below:

	Standalone							
Particulars	Quarte	r ended	Half yea	Year ended				
i al ticulais	30 Sept. 2019	30 Sept. 2018	30 Sept. 2019	30 Sept. 2018	31 March 2019			
		(Audited)						
Revenue from operations and other income	5564.66	5062.53	11058.82	10346.21	23408.62			
Profit before tax	571.40	681.61	1150.77	1299.17	3137.20			
Profit after tax	568.49	471.80	970.89	954.00	2217.62			

Place : Ahmedahad Date: 12 November, 2019

(a) Basic

(b) Diluted

Place: Raipur, Date: 12.11.2019

By Order of the Board of Directors Manoi B Vadodaria **Chairman and Managing Director** DIN: 00092053

29 45

29.45

38.38

38.38

Sd/- Abhishek Agrawal, Executive Director

GODAWARI POWER AND ISPA GODAWARI POWER & ISPAT GODAWARI POWER & ISPAT Regd. Office: 428/2,Phase-I, Industrial Area, Siltara,Raipur (C.G.) Corporate Office: Hira Arcade, Pandri, Raipur (C.G.) 492001 CIN.: L27106CT1999PLC013756, Tel: 0771-4082000 Fax: 0771-4057601, Website: www.godawaripowerispat.com E-mail: yarra.rao@hiragroup.com

EXTRACT OF CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED 30TH SEPTEMBER, 2019 3 MONTHS ENDED 6 MONTHS ENDED YEAR ENDED **Particulars** 31.03.2019 30.09.2019 30.06.2019 30.09.2018 30.09.2019 30.09.2018 Unaudited Unaudited Unaudited Unaudited Unaudited Audited Total income from Operations 829.43 835.50 805.36 1.664.93 1.526.30 3,327.49 Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items) 87.02 107.02 164.5 195.17 409.74 Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or 87.02 77.49 107.02 164.51 195.17 409.74 Extraordinary items) Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or 52.95 56.91 67.97 109.87 124.17 256.83 Extraordinary items) Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive 48.57 57.79 65.36 106.36 124.48 246.81 Income (after tax)] 6 Paid Up Equity Share Capital 34.11 34.11 34.11 34.11 34.11 34.11 Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) -

Notes: 1 The Financial Results of the company for the quarter and half year ended on 30th September, 2019 have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on 11th November, 2019 and 12th November, 2019 and the Limited Review of the same has been carried out by the Auditors, 2. The above is an extract of the detailed format of financial results filed for the quarter & half year ended 30.09.2019 filed with stock exchanges under regulation 33 & other applicable provisions of the SEBI (Listing Obligations and Disclouser Requirements) Regulations, 2015. The full

13.00

13.00

16.45

16.45

18.90

18.90

format of the financial results are available on the stock exchange web (www.godawaripowerispat.com) 3. The additional Information on Standalo				idia.com) and	on the Comp	pany's website
Particulars	3	MONTHS END	ED	6 MONTHS	YEAR ENDED	
1 diticulais	30.09.2019	30.06.2019	30.09.2018	30.09.2019	30.09.2018	31.03.2019
	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited
Total Income From Operations	681.16	728.99	713.20	1,410.15	1,357.12	2,878.24
Profit/(Loss) before tax	49.03	64.98	97.28	114.01	184.35	349.99
Profit/(Loss) after tax	32.85	40.51	61.83	73.36	117.36	213.26
l .				For and an I	habalf of Book	rd of Directors

Kapodara Branch: Jay Complex, Uper Ground Floor, Opp.Hira Baug Circle, Kapodara Varachha Main Road, Surat. India Ph.: 0261-2545425, 2545424



SYMBOLIC POSSESSION NOTICE (IMMOVABLE PROPERTY)

Whereas, The undersigned being the authorized officer of the BANK OF BARODA under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a Demand Notice dated 04/08/2018 calling upon the Borrower Mr. Mayank Kanaiyal Mehta and Mr. Kanaiyalal Nandlal Mehta to repay the amount mentioned in the notice being Rs.20,37,341/- (Rupees Twenty Lacs Thirty Seven Thousand Three Hundred Fourty One Only) and interest thereon w.e.f. 31.07.2019 within 60 days from the date of receipt of the said notice.

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Symbolic possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest Enforcement) Rules, 2002 on this the 11th day of November of the year 2019.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower in particular and the public in general is hereby cautioned not to dea with the property and any dealings with the property will be subject to the charge of Bank of Baroda, Kapodara Branch, Surat for an amount of Rs.20,37,341/ (Rupees Twenty Lacs Thirty Seven Thousand Three Hundred Fourty One Only) and interest thereon

All that Part and Parcel of the property: Flat No. B/2-301 Shri Vinayak Residency. Block No. 190, F.P. 50/A, TPS 24, Mota Varachha, Surat, Guiarat -394101, Bounded On the North: Garden Valley. On the South: Adi. Blg No. B. On the East: O.P.No. 49 On the West: Vinayak Arcade

Date: 11/11/2019

BALRAMPUR CHINI MILLS LIMITED

CIN – L15421WB1975PLC030118 Registered Office: FMC Fortuna, 2nd Floor 234/3A, A.J.C. Bose Road, Kolkata 700 020 Tel: +91 33 2287 4749 Fax: +91 33 2287 3083 Email: secretarial@bcml.in, Website: www.chini.com

Public Notice

Regional Manager: Bank of Baroda, Regional Office: Bharuch

DEMAND NOTICE

Under Section 13(2) of the Securitisation And Reconstruction of Financial Assets And Enforcement of Security Interest Act, 2002 (the said Act, read with Rule 3 (1) of the Security Interest (Enforcement) Rules, 2002 (the said Rules). In exercise of powers conferred under Section 13 (12) of the said Act read with Rule 3 of the said Rules, the Authorised Officer of IIFL Home Finance Ltd. (IIFL HFL) / (formerly known as India Infoline Housing Finance Limited) has issued Demand Notices under section 13(2) of the said Act, calling upon the Borrower(s), to repay the amount mentioned in the respective Demand Notice(s) issued to them. In connection with above, notice is hereby given, once again, to the Borrower(s) to pay within 60 days from the publication of this notice, the amounts indicated herein below, together with further interest from the date(s) of Demand Notice at late of payment. The detail of the Borrower(s) amount due as on date of Demand Notice and security offered towards repayment of loan amount are as under:

| Name of the Borrower(s) | Demand Notice | Demand Notice | Description of secured asset (immovable property) | Demand Notice | Description of secured asset (immovable property) |

[Natipura, Kantin Call, Source, Source of the Act and the applicable Rules, entirely at the risks, above secured assets under Section 13(4) of the said Act. and the applicable Rules, entirely at the risks,

costs and consequences of the Borrowers.

For, further details please contact to Authorised Officer at Branch Office: IIFL HFL 6/216, Rustampur, Road, Udhan Darwaja, Aman Nagar, Surat, Gujarat 395002 and /or Corporate Office: Plot No. 98, Phase-IV, Udyog Vihar, Gurgaon, Haryana.

Jace: Surat Date: 13.11.2019

Sd/- Authorised Officer, For IIFL Home Finance Limited

We are glad to inform you that our below mentioned existing branch at RAJPIPLA

(Erstwhile Vijava Bank). Dist. Narmada is now going to merged with our VADIA

PALACE Branch on 06/02/2020 and GIDC. ANKLESHWAR (Erstwhile Dena Bank)

Dist. Bharuch is now going to merged with our ANKLESHWAR MSME Branch

(Erstwhile Vijaya Bank) on 04/02/2020 for better Customer Service & Ample

बैंक ऑफ़ बड़ौदा

Bank of Baroda

Existing Branch/Code

Vijaya Bank, Rajpipla Branch Shop No.A-1, B-1 to 3, Vraj Avenue

Opposite CPVM College, M. V. Road

RAJPIPLA, Dist. Narmada-393145

(2) Dena Bank, GIDC Ankleshwar Brand

Onnosite Asonalay Guest House,

GIDC, ANKLESHWAR-393002

1st Floor, Ambica Shopping Centre

(INDIA)

SOL ID: 6904

(GUJARAT, INDIA)

SOL ID: 0868

Place: Kolkata

Mr. Amratlal Kanjibhai Navsariwalla, M/s Maa Laxmi Corporation, Mrs. Bhagwatiben Amratlal Navsariwala, Mr. Fenis A Navsariwala, Mr. Renol A

avsariwala Mr Allwyen A

Navsariwala (Prospect No. / Loan A/c No. 714105)

(₹ In lakhs)

Demand Notice Description of secured asset (immovable property)

Rs.67,25,211 No.101, 1st Floor,rundavan Complex,opposite (Rupees Sixty) Gokul Row House, near Gateway h Seven Lakh Twenty Hotel,umarinagar School Road,umara, Surat, Five Thousand Two Gujarat, (ii) Property Bearing Survey 272 and Hundred Eleven 273, admeasuring 28.61 sq. Mtrs. Along with 9.83, sq. mtrs, construction of ward no.1 of Moje, Nanpura, kanthi Gali, Surat, Gujarat.

Nanpura, kanthi Gali, Surat, Guiarat,

POWER)

OF)

Branch Name & Code

(To be Merged with)

Vadia Palace, RAJPIPLA,

2) MSME Ankleshwar Branch,

ANKLESHWAR-393002

02646-222514, 250158

(GUJARAT, INDIA)

Branch Contact No.

SOL ID: 7325

Dist. Narmada-393145 (INDIA)

Tehsil: Nandod.

1) Vadia Palace Branch, Ambika Naga

Society, Near Kaliva Bhoot Temple

Branch Contact No.: 02640-222900

P.B.No. 173, Indraprasth Complex

Near Hotel Mahashiv, Old N.H.Road,

The Public Notice is hereby given that pursuant to Regulations 6(a), 7 and other applicable regulations, if any, of the Securities and Exchange Board of India (Delisting of Equity Shares) Regulations 2009, as amended, (the "Delisting Regulations"), Balrampur Chini Mills Limited (the Company) is in the process of making application for voluntary delisting of its equity shares from The Calcutta Stock Exchange Limited (CSE).

At present the equity shares of the Company are listed on BSE Limited (BSE), National Stock Exchange of India Limited (NSE) and CSE. The Board of Directors of the Company at its meeting held on Monday, 11th November, 2019 has approved voluntary delisting of the equity shares of the Company from CSE pursuant to Regulation 6(a) of the Delisting Regulations considering that there is no trading in the equity shares of the Company on CSE.

The equity shares of the Company shall continue to remain listed on BSE and NSE which are the recognized stock exchanges and are having nation-wide trading terminals

> For Balrampur Chini Mills Limited Sd/-

Nitin Bagaria Company Secretary - GM Legal

ACS No.: 20228

Date: 11th November, 2019



Motilal Oswal Home Finance Limited CIN: U65923MH2013PLC248741

Regd. Office: Motilal Oswal Tower, Rahimtullah Sayani Road, Opp. Parel ST Depot, Prabhadevi, Mumbai-400025 Tel: + (022) 4718 9999 Website: www.motilaloswalhf.com

E-mail: hfquery@motilaloswal.com **PUBLIC NOTICE**

NOTICE is hereby given to the public at large that Motilal Oswal Home Finance Limited (MOHFL) (Formerly Known as Aspire Home Finance Corporation Limited) (AHFCL), a Housing Finance Company registered with National Housing Bank (NHB), having its registered office at Motilal Oswal Tower, Rahimtullah Sayani Road, Opp. Parel ST Depot, Prabhadevi Mumbai – 400 025, intends to shift its Branch office from Shop No. 307, 3rd Floor, Proton Plus, Plot No.45, Opposite Khodiyar Temple, L.P. Savani Road, Adajan, Surat 395009, Gujarat to Office No.1026,1027 & 1028, 1st Floor, World Trade Centre, 21st Century Bldg, Nr. Udhna Darwaja, Ring Road, Surat - 395 002, Gujarat w.e.f. February 26th, 2020.

The customers who are serviced from the location which is being shifted will be serviced from the new location.

All concerned are requested to take note of same

1.20

For Motilal Oswal Home Finance Limited

(Formerly Known as Aspire Home Finance Corporation Ltd)

Place · Mumbai Date: 13th November, 2019 Vijay Kumar Goel CEO

1.81



ASAHI INDIA GLASS LIMITED

Registered Office: Unit No. 203 to 208, Tribhuwan Complex, Ishwar Nagar, Mathura Road, New Delhi - 110 065 Phone: (011) 49454900 Corporate Office: 5th Floor, Tower - B, Global Business Park, Mehrauli - Gurgaon Road. Gurugram - 122 002 (Haryana) CIN: L26102DL1984PLC019542 Phone: (0124) 4062212-19 Fax No.: (0124) 4062244/88 Website: www.aisglass.com E-mail: investorrelations@aisglass.com

	UNAUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE SECOND QUARTER AND HALF YEAR ENDED 30™ SEPTEMBER, 2019								
				(₹ Lakhs)					
SI.		Quarter ended	Half Year ended	Quarter ended					
No.	Particulars	30.09.2019	30.09.2019	30.09.2018					
NU.		Unaudited	Unaudited	Unaudited					
1	Total Income from Operations	64,988	1,36,670	76,507					
2	Net Profit for the period (before Tax, Exceptional and / or Extraordinary items)	4,388	10,335	6,280					
3	Net Profit for the period before tax (after Exceptional and / or Extraordinary items)	4,388	10,335	6,267					
4	Net Profit for the period after tax (after Exceptional and / or Extraordinary items)	2,847	6,781	4,370					
5	Total Comprehensive Income for the period [comprising Profit for the period (after tax) and Other								
	Comprehensive Income (after tax)]	2,631	6,445	4,176					
6	Equity Share Capital	2,431	2,431	2,431					
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year		1,19,138						
8	Earnings Per Share (of Re. 1/- each) (for continuing and discontinued operations) (not annualised)								
	(a) Basic	1.20	2.84	1.81					

					(₹ Lakhs)
1	.		Quarter ended	Half Year ended	Quarter ended
Į;	SI. No.	Particulars	30.09.2019	30.09.2019	30.09.2018
ľ	VU.		Unaudited	Unaudited	Unaudited
	1 T	otal Income from Operations	63,887	1,34,152	75,672
	2 P	Profit before tax	4,722	10,868	6,522
Г	3 P	Profit after tax	3,070	7,084	4,265

KEY STANDALONE FINANCIAL INFORMATION FOR THE SECOND QUARTER AND HALF YEAR ENDED 30™ SEPTEMBER, 2019

The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the websites of BSE and NSE at www.bseindia.com 8 www.nseindia.com respectively and on company's website at www.aisglass.com.

The above financial results have been reviewed by the Audit & Risk Management Committee and approved by the Board of Directors at their meeting held on 12th November, 2019.

1. The financial results of the Company have been prepared in accordance with Indian Accounting Standards ("Ind AS") notified under the Companies (Indian Accounting Standards) (Amendment) Rules, 2015 as amended by the Companies (Indian Accounting Standards) (Amendment) Rules, 2016, recognition and measurement principles in Ind AS 34 Interim Financial Reporting prescribed under Section 133 of the Companies Act, 2013 read with rules issued thereunder and the other accounting principles generally accepted in India.

Effective 1st April, 2019, the Company adopted Ind AS 116 "Leases" applied to all lease contracts existing on 1st April, 2019 using the modified retrospective method and has taken the cumulative adjustment to retained earnings on the date of initial application. The adoption of the Standard did not have any material impact on the profit of the current quarter.

> Saniav Labroo **Managing Director & Chief Executive Officer**

2.84

Place: Gurugram

(b) Diluted

71.55

71.55

Date: 12th November, 2019

For and on behalf of the Board of Directors

ટ્રાન્સ યુનિયન સિબિલના તાજેતરમાં હાથ ધરાયેલા અભ્યાસના મહત્વના તારણો બીજા ત્રિમાસિકમાં દેશનો જીડીપી મિલેનિયલ્સ અન્ય ગ્રાહક કરતાં ધિરાણ પરત્વે વધુ સતર્ક

૨૦૧૬થી ૨૦૧૮ વચ્ચે નવું ક્રેડિટ કાર્ડ કે લોન લેતાં મિલેનિયલ્સની સંખ્યામાં ૫૮ ટકા વધારો થયો

ટ્રાન્સયુનિયન તાજેતરમાં હાથ ધરેલા એક મોનિટરિંગ મિલિનિયલ મહારાષ્ટ્ર, ૭૨ ટકા લોનનો હિસ્સો ક્રેડિટ અભ્યાસમાં મહત્વનો ખુલાસો કર્ણાટક, તમિલનાડુ, ઉત્તરપ્રદેશ કાર્ડ, પર્સનલ લોન્સ અને કન્ઝ્યુમર સામે આવ્યો કે, વર્ષ ૨૦૧૬થી વર્ષ અને દિલ્હીમાંથી છે, ત્યારે ૭૪૭નાં ડ્યુરેબલ લોન્સનો છે. ૨૦૧૮ વચ્ચે સેલ્ફ-મોનિટરિંગ સરેરાશ સ્કોર સાથે ધિરાણ પ્રત્યે ભારતીય મિલેનિયલ ૧ માં ૫૮ સતર્ક મિલેનિયલ્સમાં ગુજરાતનો અને ઓટો લોનની સૌથી વધુ માગ ટકા સુધીનો વધારો થયો હતો, ત્યારે રેન્ક ટોચ પર છે. ધિરાણ પ્રત્યેની સભાનતા ધરાવતાં નોન-મિલેનિયલ ગ્રાહકોમાં ફક્ત સ્થાન ૭૪૩નાં સ્કોર સાથે ૧૪ ટકાનો વધારો થયો હતો. હરિયાણાનું અને ૭૪૨નાં સ્કોર સિબિલનાં ડાયરેક્ટ ટૂ કન્ઝ્યુમર તેમની ધિરાણ લેવાની ઊંચી ક્ષમતા સાથે ત્રીજું સ્થાન રાજસ્થાનનું હોવા છતાં અભ્યાસમાં જાણકારી છે. યાદીમાં સૌથી નીચે ૭૩૪નાં મળી હતી કે, મિલેનિયલ દેશમાં સિબિલ સ્કોર સાથે દિલ્હીનું છે અને ધિરાણ પ્રત્યે સજાગ કન્ઝ્યુમર એની આગળ ૭૩૬ સિબિલ સ્કોર ધિરાણમાં સતર્કતા અને ધિરાણની સેગમેન્ટમાંનો એક છે.

આ ધિરાણ પ્રત્યે સજાગ

સિબિલે ધરાવે છે. જ્યારે ૫૧ ટકા સેલ્ફ- સેગમેન્ટ દ્વારા તમામ લોનમાંથી

ત્યારબાદ આ દ્રષ્ટિએ બીજું સાથે તમિલનાડુનું છે.

અભ્યાસમાં જણાવ્યા મુજબ, મિલેનિયલ પોતાનાં ક્રેડિટ સ્કોર સેલ્ફ-મોનીટરિંગ મિલેનિયલ્સ પર નિયમિતપણે નજર રાખે છે. અનસીક્ચોર્ડ ક્રેડિટ માટે પસંદગી. હાંસલ કરવા ધિરાણની તકોનો. ચકાસે છે.

સીક્યોર્ડ લોનમાં ટુ વ્હીલર લોન બાબત છે. ધિરાણની વર્તણૂંક વિશે ટ્રાન્સયુનિયન ઇન્ટરેક્ટિવનાં વીપી અને હેડ સુજાતા આહલાવતે જણાવ્યું હતું કે, ભારતીય મિલેનિયલ્સ દ્વારા સારી વર્તણૂંકમાં વધારાનાં ટ્રેન્ડને જોવા પ્રોત્સાહનજનક બાબત છે.

અને સરેરાશ ૭૪૦ સિબિલ સ્કોર ધરાવે છે, જેમાં આ કન્ઝ્યુમર ઉપયોગ કરતાં હોવાથી તેમણે તેમનાં જીવનનાં પાછળનાં તબક્કાઓમાં લોનની સુલભતા નક્કી કરવામાં તેમનાં સિબિલ સ્કોરની ભૂમિકાથી

> છે, જે સંયુક્તપણે કુલ ધિરાણમાં ૯ છે કે, ઘણાં ધિરાણકારોએ પ્રસ્તુત ટકા પ્રદાન ધરાવે છે. મિલેનિયલની પ્રોડક્ટ ઓફર સાથે આ વર્ગ સુધી પહોંચવાની શરૂઆત કરી દીધી છે. ઘણાં મિલેનિયલ્સે તેમની ધિરાણની સફર શરૂ કરી હોવાથી તેમનાં સુધી પહોંચવાનો યોગ્ય સમય છે, જેથી ધિરાણકારોને તેમનાં ધિરાણનાં ચક્રમાં તેમની સાથે જોડાયેલા રહેવામાં મદદ મળશે. તેમણે ઉમેર્યું હતું કે, મિલેનિયલ્સ તેમનાં સિબિલ તેઓ તેમનાં નાણાકીય લક્ષ્યાંકો સ્કોર અને રિપોર્ટને નિયમિતપણે

સરેરાશ સેલ્ફ-મોનિટરિંગ મિલેનિયલ્સ તેમનો સિબિલ, રિપોર્ટ કે અપડેટ વર્ષમાં ૬ વાર જુએ છે. જ્યારે તેમાંથી ૬૪ ટકા લોકો તેમનો વાકેફ થવું જોઈએ એ મહત્ત્વપૂર્ણ સ્કોર ચકાસ્યાં પછી ૩ મહિનાની અંદર ધિરાણ મેળવવા અરજી કરે એ જોવું રસપ્રદ બાબત પણ છે, ત્યારે ૩૪ ટકા નવા ક્રેડિટ કાર્ડનો લાભ લે છે અથવા નવું લોન ખાતું

> હવે તેમને ધિરાણની પોઝિટિવ કામગીરી અને સિબિલનો ઊંચો સ્કોર ઊભો કરવા અને જાળવવાનું મહત્વ સમજાયું છે. આ ધિરાણ પ્રત્યેની સતર્કતા તેમને ઓછા વ્યાજ દરે ધિરાણની ઓફરનો લાભ લેવા સક્ષમ બનાવવામાં મદદરૂપ થશે,

ખોલાવે છે.

ગ્રોથ ૪.૨ ટકા રહેવાની સંભાવના

મંગળવારે એક રિપોર્ટ જાહેર વર્ષ ૨૦૧૯ના પહેલા ત્રિમાસિકમાં આર્થિક વિકાસના સંકેત સતત આવી કર્યો છે. જેના અનુસાર, બીજા ત્રિમાસિકમાં દેશનો જીડીપી ગ્રોથ ૪.૨ ટકા રહેવાની સંભાવના છે. SBIએ કહ્યું કે, ઓટોમોબાઈલના વેચાણમાં ઘટાડો, કોર સેક્ટર ગ્રોથમાં ઘટાડો અને કન્સ્ટ્રક્શન કહ્યું છે કે, ચાર મહિનાની દક્ષિણ માંગમાં માસીક ધોરણે જોવા મળેલો તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ ઘટવાને કારણે દેશના જીડીપી ગ્રોથમાં પણ ઘટાડો જોવા મળશે. વિત્ત વર્ષ ૨૦૨૦ માટે ગ્રોથનું અનુમાન પહેલાં ૬.૧ ટકાથી કહેવામાં આવ્યું છે કે, સપ્ટેમ્બર ઘટીને હવે ૫ ટકા કરી દેવામાં ૨૦૧૯ના IIP ગ્રોથનાં આંકડો આવ્યું છે. SBI પહેલાં અન્ય પણ ૪.૩ ટકા રહ્યો હતો, જે વૈશ્વિક એજન્સીઓ જેવી કે ADB, ચિંતાજનક છે. અમે વિત્ત વર્ષ માગ ઘટવી એ એક વધુ પડકાર

ઘટાડી દીધો છે. લેવા માટે અરજી કરવા સક્ષમ િનમ્ન સ્તર પ ટકા પર આવી ગયો વૃદ્ધિ આવશે અને તે ૬.૨ ટકા રહી ટકા અને ગુજરાતમાં ૧૮.૮ ટકા ઘટી હતો. SBIએ પોતાની રિપોર્ટમાં શકે છે.

વિત્ત વર્ષ ૨૦૨૦ના ગ્રોથ રેટને

કહ્યું છે કે, અમારા ૩૩ હાઈ વૃદ્ધિ દેખાડી હતી જે ૬૫ ટકા હતી. અને હવે તે ઘટીને વિત્ત વર્ષ ટકાના સ્તરે આવી ગઈ છે.

પશ્ચિમ મોનસૂનના સમયગાળામાં આ સૌથી મોટો ઘટાડો છે. ૬ વર્ષના દેશમાં ૧૧૦ ટકા સુધી વરસાદ થયો છે. જે સામાન્ય કરતાં વધારે છે. એસબીઆઈના રિપોર્ટમાં વર્લ્ડ બેંક, RBI અને IMFએ પણ ૨૦૨૦ માટે પોતાના ગ્રોથનું છે. રાજયના અર્થતંત્રમાં કૃષિ કરતાં અનુમાન પહેલાં ૬.૧ ટકાથી ઔદ્યોગોનું વધારે મહત્વ ધરાવતા ઘટાડીને પ ટકા કરી દીધું છે. પહેલા ત્રિમાસિકમાં દેશનો રિપોર્ટમાં અનુમાન કરાયું છે કે, ત્યારે હોમ લોન જેવી મોટી લોન જીડીપી ગ્રોથ પહેલાં જ ૬ વર્ષનાં વિત્ત વર્ષ ૨૦૨૧માં ગ્રોથ રેટમાં છે. મહારાષ્ટ્રમાં વીજળીની માંગ ૨૨.૪

ઑક્ટોબરમાં વીજળીની માંગમાં ૧૩.૨%નો ઘટાડો ન્યુ દિલ્હી,તા.૧૨

વિશ્વમાં સૌથી વધુ ઝડપે વિકસી દેશની સોથી મોટી બેંક SBIએ ફિકવન્સી લીડિંગ ઈન્ડિકેટર્સે વિત્ત રહેલા ભારતીય અર્થતંત્ર માટે નબળા રહ્યા છે. આઠ વર્ષમાં સૌથી નીચા ઔદ્યોગીક ઉત્પાદન બાદ દેશમાં ૨૦૨૦ની બીજી ત્રિમાસિકમાં ૨૭ વીજળીની માંગ ઓકટોબરમાં ૧૩.૨ ટકાના દરે ઘટી હોવાનું સામે આવ્યું આ ઉપરાંત સ્કાયમેટે પણ છે. છેલ્લા ૧૨ વર્ષમાં વીજળીની આર્થિક વિકાસદરના નબળા આંકડા પછી સપ્ટેમ્બરમાં ઔદ્યોગીક ઉત્પાદન સંકોચાઇ ૪.૩ ટકા આવ્યા બાદ ૨૦૨૪ સુધીમાં પાંચ લાખ કરોડ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું સપનું જોતા નીતી ઘડવૈયા માટે વીજળીની ગુજરાત અને મહારાષ્ટ્રમાં વીજળીની માગમાં વધારે ઘટાડો જોવા મળી રહ્યો હોવાનું રિવ્યુમાં જાણવા મળ્યું છે.

કોટનમાં ૫૫,૮૨૫ ગાંસડીના નોંધપાત્ર વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં સેંકડા ઘટ્યા સીપીઓ, એલચી, મેન્થા તેલમાં વૃદ્ધિ : સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ

ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ પર રૂ.૧૭ ઘટીને બંધમાં રૂ.૩૭૬૮૮ ના મંગળવારના રોજ ગુરૂનાનક જયંતી ભાવ રહ્યા હતા. નિમિત્તે પ્રથમ સત્રનાં કામકાજ બંધ રહ્યાં હતાં, જ્યારે બીજા સત્રનું કામકાજ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રાબેતા મુજબ ચાલુ હતું. સોમવારે રૂ.૪૪૧૦૦ ખૂલી, ઊપરમાં મોડી રાત્રે પૂરા થતાં બંને સત્રમાં રૂં.૪૪૧૯૭અને નીચામાં રૂ.૪૩૬૦૬ મળીને વિવિધ કોમોડિટી વાયદા ના સ્તરને સ્પર્શી બીજા સત્રનાં અંતે અને ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.૧૧૪ વધીને રૂ.૪૩૯૮૬ બંધ રહ્યો દદ્દ ૭૬૩૮ સોદામાં રૂ.૩૨૭૮૨.૮૬ હતો. ચાંદી-મિની નવેમ્બર રૂ.૧૧૪ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં વધીને રૂ.૪૪૦૦૬ અને ચાંદી-માઈક્રો કોમોડિટી વાયદાઓનો હિસ્સો નવેમ્બર રૂ.૧૦૧ વધીને રૂ.૪૪૦૦૦ રૂ.૩૧૮૯૮.૬૮ કરોડનો અને બંધરહ્યા હતા. ઓપ્શન્સનો હિસ્સો રૂ.૮૮૪.૧૮ કરોડનો રહ્યો હતો. કોમોડિટી સોદાઓમાં કુલ રૂ.૪૫૯૪.૮૬ વાયદાઓમાં કીમતી ધાતુઓના કરોડના વેપાર થયા હતા. વાયદાના ભાવમાં સામસામાં રાહ એલ્યુમિનિયમ નવેમ્બર કોન્ટ્રેક્ટ હતા. સોનાના વાયદા ઘટવા સામે કિલોદીઠ રૂ.૧.૬૫ ઘટીને રૂ.૧૩૪ ચાંદી વધીને બંધ રહી હતી. બિનલોહ અને તાંબુ નવેમ્બર રૂ.૧.૭ ઘટીને ધાતુઓમાં મિશ્ર વલણ વાયદાના રૂ.૪૪૦.૭ થયા હતા, જ્યારે સીસું ભાવમાં હતું. એલ્યુમિનિયમ, તાંબુ, નવેમ્બર ૪૦ પૈસા ઘટીને રૂ.૧૫૬.૨ નિકલ અને સીસું ઘટ્યા હતા, તથા નિકલ નવેમ્બર રૂ.૩૧.૨ ઘટીને જ્યારે જસત વધ્યું હતું. એનર્જી બીજા સત્રનાં અંતે રૂ.૧૧૩૯.૮ બંધ સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં મામૂલી સુધારા રહ્યા હતા. જસત નવેમ્બર રૂ.૧.૧૫ ટન, તાંબામાં ૯૨૫૧ સોદાઓમાં ઓપ્શન્સનો રૂ.૩૮૦૦૦ ની સ્ટ્રાઈક સામે નેચરલ ગેસ ઢીલું હતું. કૃષિ વધીને બંધમાં રૂ.૧૯૫.૮૫ ના ભાવ રૂ.૧૨૬૨.૨૭ કરોડનાં ૨૮૬૧૦ પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ કોમોડિટીઝમાં કોટનમાં ૫૫,૮૨૫ રહ્યા હતા. ગાંસડીના નોંધપાત્ર વોલ્યુમ સાથે આપન ઇન્ટરેસ્ટ ૮૯,૧૫૦ ગાસડીના 🛮 ૪૫૫૬૭૮ સ્તરે રહ્યો હતો. કોટનના વાયદાના રૂ.૧૭૫૨૫.૨૩ કરોડનો ધંધો થયો રૂ.૧૨૯૭.૮૬ કરોડનાં ૧૧૨૫૬ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં

ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.૪૦૭૮ બંધ રહ્યો હતો, જ્યારે કુલ ૧૧૯૭૦૯ સોદાઓમાં નેચરલ ગેસ નવેમ્બર કોન્ટ્રેક્ટ બીજા રૂ.૯૨૮૧.૨૩ કરોડનાં કામકાજ સત્રનાં અંતે રૂ.૧૨ ઘટીને બંધમાં થયાં હતાં. સોનાના વાયદાઓમાં રૂ.૧૮૮.૨ રહ્યો હતો. એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો રૂ.૩૭૫૧૦ ના મથાળે અથડાઈ પ્રથમ વાયદો ગાંસડીદીઠ રૂ.૧૯૧૫૦ ખૂલી, સંત્રનાં અંતે રૂ.૭ ઘટીને રૂ.૩૭૬૮૦ ઊપરમાં રૂ.૧૯૨૧૦ અને નીચામાં

દેશના અગ્રણી કોમોડિટી મિની ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ

ચાંદીના વાયદાઓમાં ચાંદી

એનર્જી કોમોડિટી વાયદાઓમાં કીમતી બોલાઈ બીજા સત્રનાં અંતે રૂ.ર વધીને સોદાઓમાં

રૂ.૩૮૪૭ થયા હતા, જ્યારે સોનું- રૂ.૬૪૩ ના ભાવ હતા, જ્યારે એલચી નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ. ૨૪૫૨.૧ સોનાના વાયદાઓમાં ૨૧૭૩૩.૪૨૭ ખૂલી, અંતે રૂ.૩.૭ વધીને રૂ.૨૫૨૪ કિલો, ચાંદીના વાયદાઓમાં થયો હતો. મેન્થા તેલ નવેમ્બર વાયદો પપ૪.૯૨૧ ટન, એલ્યુમિનિયમમાં કિલોદીઠ રૂ.૧૨૮૧.૨ ખૂલી, ઊપરમાં ૧૬૭૨૩ ટન, તાંબામાં ૨૦૨૩૭.પ રૂ.૧૨૯૮ અને નીચામાં રૂ.૧૨૭૯.૩ ટન, સીસામાં ૯૬૨૬ ટન, નિકલમાં રહી, અંતે રૂ.૧૨૯૫.૩ બંધ રહ્યો ૨૨૭૦.૭૫ ટન, જસતમાં ૨૪૫૫૦ હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ ટન, ક્રૂડ તેલમાં ૨૬૬૯૦.૬ બેરલ્સ, કિલોદીઠ રૂ.૧૦૬૫.૫ ખૂલી, ઊપરમાં નેચરલ ગેસમાં ૩૦૨૨૩૭.૫ રૂ.૧૦૭૦ અને નીચામાં રૂ.૧૦૫૯ એમએમબીટીયૂ, કોટનમાં ૮૯૧૫૦ સુધી જઈ બીજા સત્રનાં અંતે રૂ.૪.૦૦ ગાંસડી, સીપીઓમાં ૭૨૭૩૦ ટન, ઘટીને રૂ.૧૦૬૨.૫ ના સ્તરે બંધ રહ્યો એલચીમાં ૧૮.૧ ટન, મેન્થા તેલમાં

બિનલોહ ધાતુઓમાં ૭૭૪૯૪ બીજા સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૨૮૩૭૬ સોદાઓમાં કુલ રૂ.પપ૨૯.૪૭ કરોડ ની કીમતનાં ૧૪૬૬૧.૧૦૪ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૯૧૩૩૩ સોદાઓમાં કીમતનાં ૮૫૨.૩૯૮ ટન, એલ્યુમિનિયમમાં ૪૫૮૬ સોદાઓમાં રૂ.૧૭૫.૦૭ કરોડનાં ૧૨૯૭૪ વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ સેગમેન્ટમાં કુલ રૂ.૪૫૨.૪૧ કરોડનાં ૨૮૯૦૩ રૂ.૨૪૦ અને નીચામાં રૂ.૧૪૫ સાંદાઆમાં ટન, નિકલમાં ૩૧૬૨૮ સાંદાઓમાં રહી બીજા સત્રના અતે રૂ.૧૭૬ બધ ભાવમાં સેંકડા ઘટી આવ્યા હતા. હતો. ક્રૂડ તેલ નવેમ્બર કોન્ટ્રેક્ટ ટન, જસતમાં ૨૨૪૮૦ સોદાઓમાં રૂ.૩૭૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો સીપીઓ, એલચી અને મેન્થા તેલમાં બેરલદીઠ રૂ. ૪૦૬૨ ખૂલી, ઊપરમાં રૂ.૧૪૦૭.૨૫ કરોડનાં ૭૨૨૪૭ નવેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૯૬ વૃદ્ધિ સામે કપાસના વાયદા નરમ હતા. રૂ.૪૦૯૯ અને નીચામાં રૂ.૪૦૧૮ ટેન, ક્રૂડ તેલમાં ૩૮૩૨૨૨ ખૂલી, ઊપરમાં રૂ.૧૪૫ અને નીચામાં કરોડનાં ૩૬૦૬૫૬૧૦ બેરલ્સ, બંધરહ્યો હતો. નેચરલ ગેસમાં ૭૨૪૫૬ સોદાઓમાં રૂ.૨૮૯૩.૬૮ કરોડનાં વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ૧૫૧૦૯૫૦૦૦ એમએમબીટીયુ, કૃષિ કોમોડિટીઝમાં પદ્રદય કોટનમાં ૧૪૬૭ સોદાઓમાં પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૧૦ ગ્રામદીઠ રૂ.૩૭૬૮૭ ખૂલી, સોદાઓમાં કુલ રૂ.૪૯૭.૩૭ કરોડનાં રૂ.૧૦૬.૩૯ કરોડનાં ૫૫૮૨૫ રૂ.૧૦૧ ખૂલી, ઊપરમાં રૂ.૪૧૫ અને ઊપરમાં રૂ.૩૭૮૪૮ અને નીચોમાં કામકાજ થયાં હતાં. કોટન નવેમ્બર ગાંસડી, સીપીઓમાં ૨૮૫૨ નીચામાં રૂ.૧૦૦ રહી બીજા સત્રનાં સોદાઓમાં રૂ.૩૨૦.૧૭ કરોડનાં અંતે રૂ.૩૨૭.૫ બંધ રહ્યો હતો, જ્યારે ૪૯૮૩૦ ટન, એલચીમાં ૫૬ પુટ ઓપ્શન્સમાં રૂ.૪૭૦૦૦ ની બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની નવેમ્બર રૂ.૧૯૦૦૦ સુધી જઈ બીજા સત્રનાં સોદાઓમાં રૂ.૧.૪૭ કરોડનાં પ.૯ સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કોન્ટ્રેક્ટ બીજા સત્રનાં અંતે રૂ.૧૭ અંતે રૂ.૧૬૦ ઘટીને રૂ.૧૯૦૬૦ ના ટન, મેન્થા તેલમાં ૧૨૨૦ સોદાઓમાં કિલોદીઠ રૂ.૩૦૪૬.૫ ખૂલી, ઊપરમાં ઘટીને ૮ ગ્રામદીઠ રૂ.૩૦૪૬૯ અને સ્તરે બંધ રહ્યો હતો. સોંપીઓ નવેમ્બર રૂ.૬૭.૫૭ કરોડનાં પ૨૩.૮ ટન, રૂ.૩૧૦૫.૫ અને નીચામાં રૂ.૨૯૦૦ ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ બીજા કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૬૩૪ ખૂલી, કપાસમાં ૭૦ સોદાઓમાં રૂ.૧.૭૭ રહી બીજા સત્રનાં અંતે રૂ.૩૦૭૩.૫ સત્રનાં અંતે રૂ.૨ ઘટીને ૧ ગ્રામદીઠ બીજા સત્રનાં અંતે રૂ.૧૨ વધીને બંધમાં કરોડનાં ૩૩૨ ટનના વેપાર થયા હતા. બંધ રહ્યો હતો.

ઓપન ઈન્ટરેસ્ટ બીજા સત્ર સુધીમાં ૪૧૬.૫૨ ટન અને કપાસમાં ૮૨૦ વાયદાઓમાં કામકાજની દેષ્ટિએ ટનના સ્તરે રહ્યો હતો.

કોમોડિટી ઓપ્શન્સમાં કુલ રૂ.૮૮૪.૧૮ કરોડનું ટર્નઓવર (નોશનલ) થયું હતું, જ્યારે પ્રીમિયમ ૭.૯૧ કરોડ નું રહ્યું હતું. ઓપ્શન્સના કુલ વોલ્યુમમાં કોલ ઓપ્શન્સનો હિસ્સો ૪૪.૫૩ ટકાનો અને પુટ કુલ રૂ.૩૭૫૧.૭૬ કરોડ ની ઓપ્શન્સનો હિસ્સો ૫૫.૪૭ ટકાનો

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી ટન, સીસામાં ૯૫૪૯ સોદાઓમાં ગ્રામદીઠ રૂ.૧૭૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૪૬૩૧.૫૫ રૂ.૮૧ રહી બીજા સત્રનાં અંતે રૂ.૧૧૦

> ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી ઓપ્શન્સનો રૂ.૪૫૦૦૦ ની સ્ટ્રાઈક

ભારતમાં સ્થિતિ ખૂબ નાજુક બનેલી છે : વોડાફોનનો મત

વોડાફોને કહ્યું છે કે, ભારતમાં તેની તરફથી લાગૂ કરવામાં આવેલી લાયસન્સ સ્થિતિ ખુબ ખરાબ થઇ ચુકી છે. કંપનીનું ફી અને સ્પેક્ટ્રેમ યુજેસ ચાર્જને લઇને હતો. ભાવિ અહેરતાલ રહેલું છે. વોડાફોને કબૂલાત – વોડાફોનના સીઈઓ નિક રીડે આજે કહ્યું – સ્પેક્ટ્રમ ચાર્જ તરીકે ચુકવવા આશરે ૪૦૦૦૦ કરતા કહ્યું છે કે, ભારતમાં તેનું ભવિષ્યે એ 🛮 હતું કે, અયોગ્ય રેગ્યુલેશન અને ખુબ વધારે 🔝 કરોડ રૂપિયા ચુકવવા માટે કહ્યું હતું. સરકારના વખત સુધી સુધરશે નહીં જ્યાં સુધી સરકાર 🛮 પડતા ટેક્સના પરિણામ સ્વરુપે નાણાંકીયરીતે 🔝 આ ફેંસલાને સુપ્રીમ કોર્ટમાં પણ યોગ્ય જાળવી ઓપરેટરો ઉપર વધારે ટેક્સ અને ચાર્જ તેમની સાથે સાથે અન્ય ઓપરેટરો ઉપર રાખવામાં આવ્યો હતો.

લાગૂ કરતી રહેશે. તેમનો ઇશારો સરકારની પણ બોજ વધી રહ્યો છે. સુપ્રીમ કોર્ટમાં પણ ચુકાદો તેમની તરફેણમાં આવ્યો નથી. સરકારે વોડાફોન-આઈડિયા પર લાયસન્સ ફી અને

NILA SPACES LIMITED (formerly known as Parmananday Superstructure Limited)

Registered Office: 1st Floor, Sambhaav House, Opp. Chief Justice's Bungalow, Bodakdev, Ahmedabad - 380 015.

		Consolidated
		(₹ in Lak
F UNAU	IDITED CONSOLIDATED FINA	INCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30 SEPTEMBER 2019
	E-mail: secretarial@nilaspaces.com W	/ebsite: www.nilaspaces.com
LED	Phone: +91 /9 4003 081//18 Fax: -	+91-79-20873922

		Consolidated							
S.N.	Particulars		Quarter ended		Half yea	Year ended			
U.III.		30 Sept. 2019	30 June 2019	30 Sept. 2018	30 Sept. 2019	30 Sept. 2018	31 March 2019		
				(Unaudited)			(Audited)		
1	Total Income from Operations	1,543.30	854.99	207.79	2,398.29	411.67	1,687.76		
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional items	393.25	152.62	77.16	545.87	115.05	309.40		
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional items)	393.25	152.62	77.16	545.87	115.05	309.40		
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional items)	331.60	135.86	105.48	467.46	132.52	288.93		
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	330.04	134.30	105.48	464.34	132.52	286.27		
6	Equity Share Capital (Face Value of ₹ 1/- per share)	3,938.89	3,938.89	3,938.89	3,938.89	3,938.89	3,938.89		
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year						7,926.57		
8	Earning per share of ₹ 1/- each (from Continuing and Discontinuing Operations)								
	Basic (in ₹)	0.08	0.03	0.03	0.11	0.03	0.07		
	Diluted (in ₹)	80.0	0.03	0.03	0.11	0.03	0.07		

The above is an extract of the detailed format of Quarterly Financial Results reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on November 12, 2019 and the same is filed with the BSE Limited and National Stock Exchange of India Limited under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of Quarterly Financial Results and Notes thereto are available on the website of the Stock Exchanges at www.bseindia.com and www.nseindia.com and also on the Company's website at www.nilaspaces.com

Additional Information pursuant to Regulation 47(1)(b) of the SEBI (LODR) Regulations, 2015 on Key standalone un-audited financial information of the company is given below:

Particulars	Standalone							
	Quarte	Half yea	Year ended					
	30 Sept. 2019	30 Sept. 2018	30 Sept. 2019	30 Sept. 2018	31 March 2019			
		(Unac	idited)		(Audited)			
Revenue from operations and other income	1469.24	207.79	2398.70	411.67	1704.29			
Profit before tax	279.38	21.78	515.63	70.31	298.57			
Profit after tax	249.37	50.10	447.17	87.78	278.10			

Place : Ahmedabad Date: 12 November, 2019

By Order of the Board of Directors Anand R Patel Managing Director DIN: 07272892

NILA INFRASTRUCTURES LIMITED

(CIN No: L45201GJ1990PLC013417)

Registered Office: 1st Floor, Sambhaav House, Opp. Chief Justice's Bungalow, Bodakdev, Ahmedabad - 380 015

Phone: +91 79 4003 6817/18 Fax: +91 79 26873922 E-mail: secretarial@nilainfra.com Website: www.nilainfra.com

S.N.	Particulars -		Quarter ended		Half yea	Year ended	
O.N.		30 Sept. 2019	30 June 2019	30 Sept. 2018	30 Sept. 2019	30 Sept. 2018	31 March 2019
				(Unaudited)			(Audited)
1	Total Income from Operations	5,662.95	5,262.52	4,725.03	10,925.47	9,713.64	21,978.54
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional items	624.24	544.46	631.88	1,168.70	1,208.51	2,803.43
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional items)	624.24	544.46	631.88	1,168.70	1,208.51	2,803.43
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional items)	584.55	385.21	441.20	969.76	896.31	2,001.25
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	582.18	382.86	438.65	965.04	891.19	2,025.56
6	Equity Share Capital (Face Value of ₹ 1/- per share)	3,938.89	3,938.89	3,938.89	3,938.89	3,938.89	3,938.89
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	Ŧ	i i	- AC	2.	2	7,895.48
8	Earning per share of ₹ 1/- each (from Continuing and Discontinuing Operations)						
	Basic (in ₹)	0.15	0.10	0.11	0.25	0.23	0.51
	Diluted (in ₹)	0.15	0.10	0.11	0.25	0.23	0.51

The above is an extract of the detailed format of Quarterly Financial Results reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on November 12, 2019 and the same is filed with the BSE Limited and National Stock Exchange of India Limited under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of Quarterly Financial Results and Notes thereto are available on the website of the Stock Exchanges at www.bseindia.com and www.nseindia.com and also on the Company's website at www.nilainfra.com.

Additional Information pursuant to Regulation 47(1)(b) of the SEBI (LODR) Regulations, 2015 on key standalone un audited financial information of the company is given below

					(₹ in Lak
			Standalone		
Particulars	Quarter ended		Half yea	ear ended 30 Sept. 2018	Year ended
i di liculoi S	30 Sept. 2019	30 Sept. 2018	30 Sept. 2019	30 Sept. 2018	31 March 2019
		(Unau	udited)	Control of the Contro	(Audited)
Revenue from operations and other income	5564.66	5062.53	11058.82	10346.21	23408.62
Profit before tax	571.40	681.61	1150.77	1299.17	3137.20
Profit after tax	568.49	471.80	970.89	954.00	2217.62

By Order of the Board of Directors

Manoj B Vadodaria **Chairman and Managing Director** DIN: 00092053

પહેલા પાનનું અનુસંઘાન

મહારાષ્ટ્રના...

પહેલાં જ એનડીએ સરકાર દ્વારા નિયુક્ત રાજ્યપાલે રાષ્ટ્રપતિ શાસન પહેલાં જ રાજ્યપાલે આજે મંગળવાર લાદવાની ભલામણ કેન્દ્ર સરકારને કરી દીધી હતી.

૯ નવેમ્બરના રોજ ગત વિધાનસભાનો કાર્યકાળ પૂરો થતાં રચવા માટેનું આમંત્રણ જ મળી શક્યું દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રીપદેથી નથી. રાજીનામુ આપ્યું હતું. જો કે રાજ્યપાલે તેમને રખેવાળ સીએમ તરીકે ચાલુ અને કોંગ્રેસના ટેકાથી સરકાર રચવાની રહેવા જણાવ્યું હતું. સૌથી મોટા પક્ષ ગણતરીમાં જ હતું પરંતુ રાજ્યપાલે તરીકે રાજ્યપાલે સૌ પ્રથમ ભાજપને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું હતું. જો કે શિવસેનાના ટેકા વગર નેતાઓ દિલ્હી-મુંબઇ વચ્ચેના સરકાર બને તેમ ન હોવાથી ભાજપે આંટાફેરાને કારણે શિવસેનાને સરકાર બનાવવાનો ઇક્રાર કરતાં બીજા અમારો ટેકો છે તેવા સત્તાવાર પત્રો સૌથી મોટા પક્ષ શિવસેનાને સરકાર શિવસેનાને આપી નહીં શકતા ૨૪ રચવાનું આમંત્રણ આપ્યું હતું. પરંતુ કલાકનો સમય પૂરો થઇ ગયો હતો શિવસેનાના મતે, રાજ્યપાલે તેમને અને ત્યારબાદ રાજ્યપાલે એનસીપીને સરકાર રચવાનો પૂરતો સમય આપ્યો આમંત્રણ આપ્યું હતું. શિવસેનાએ નથી તેથી તે સરકાર રચી શક્યા નથી. રાજ્યપાલ સમક્ષ બે દિવસનો સમય

મોટા પક્ષ એનસીપીને સરકાર રચવા કલાકનો સમય આપ્યો હોવાનું કહીને આમંત્રણ આપીને તેને પણ ૨૪ વધુ સમય આપવાનો ઇક્રાર કરતાં હતી. ચારેય ઊંડા પાણીમાં ગરક થઈ કરહી છે. પ્રથમ તબક્કામાં ૩૦મી કલાકનો સમય આપ્યો હતો. જો કે આ શિવસેનાની સત્તા મેળવવાની બાજી

કોંગ્રેસ અને શિવસેનાના ટેકાથી સરકાર રચવાનો કોઇ પ્રયાસ કરે તે બપોરે રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણ કરતાં એક રીતે જોતાં ચોથા સૌથી મોટા પક્ષ કાંગ્રેસને સરકાર

સમયગાળો પૂરો થાય અને એનસીપી

સૂત્રોએ કહ્યું કે શિવસેના,એનસીપી ૨૪ કલાકનો જ સમય આપતાં અને તે દરમ્યાન એનસીપી અને કોંગ્રેસના રાજ્યપાલે ત્યારબાદ ત્રીજા સૌથી માંગ્યો હતો. પરંતુ ભાજપને પણ ૨૪

બગડી ગઈ હતી. બાંગ્લાદેશમાં...

જો કે કેટલાક લોકો ગંભીર રીતે ઘવાયા હોવાથી મૃત્યુઆંક વધવાની સંભાવના રહેલી છે.

કેટલાક લોકો રેલવેના બે ડબાની વચ્ચે પણ કચડાયેલા હોવાનું જણાયું હતું. અકસ્માતને પગલે ઢાકા-ચત્તોગ્રામ, ઢાકા-નોઆખલી અને ચત્તોગ્રામ-સિલહટ વચ્ચેનો ટ્રેન વ્યવહાર રદ કરાયો છે. ઘટનાને પગલે જ જિલ્લા હેડક્વાર્ટરથી ડીએમ, અખુરા અને લક્સમ રેલવે જંક્શનની એસડીએમ અને ડીએસપીને બે રિલીફ ટ્રેનો દોડાવાવમાં આવી હતી લોકોને ગંતવ્ય સ્થાને પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો.

લોકો ઊંડા પાણીમાં ગરક થઈ ગયા પર ચૂંટણી લડી હતી. ઝારખંડમાં

કાર્તિકી પૂર્ણિમાને લઈને સીતામઢીના બૈરગનિયામાં રહેતા છે. ઝારખંડમાં પાંચમા અને અંતિમ રાહુલ ઝા, પંકજ મિશ્રા, સુધાંશુ મિશ્રા અને પ્રકાશ ઝા નહાવા માટે બાંગમતી નદીમાં પડ્યા હતા. અહીં ભીડ લાગી માટેની પ્રક્રિયા જોરશોરથી ચાલી

ચારેય ડૂબી ગયાના સમાચાર મળતા જ વિસ્તારમાં હંગામો મચી ગયો હતો. સ્થાનિક તરવૈયાઓએ પંકજ ઝાને સલામત રીતે બહાર કાઢી લીધો હતો, જ્યારે પ્રકાશ ઝાનું ડૂબી જવાથી મોત થઈ ગયું હતું. સુધાંશું અને રાહુલ ગુમ થયા છે. સ્થાનિક લોકોનાં હંગામાં બાદ એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

ઘટનાના સમાચાર મળતા ઘટનાસ્થળે દોડાવવામાં આવ્યા હતા.

નિર્ણય કર્યો હતો. એનડીએ ગઠબંધન હેઠળ એલજેપીએ આ જ કારણે સ્નાન વખતે ચાર લોકસભાની ચૂંટણીમાં છ સીટો કુલ ૮૧ સીટો પર પાંચ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર તબક્કામાં ચૂંટણી ૨૦મી ડિસેમ્બરના દિવસે યોજાનાર છે. ઝારખંડમાં ચૂંટણી નવેમ્બરના દિવસે મતદાન થનાર છે.





Place: Ahmedabad

